

પટલાણી

ઓણ ધોધમાર પઈડાં છે પાણી,
પદ્ધી હરખે ના કેમ પટલાણી?
ઓણ ધોધમાર પઈડાં છે પાણી!

ખેતરના શેઠા પર પાણકાનો ઢગલો
ને એના પર ઉભો પટેલ,
આખોએ હાથોનાં નેજવાં ધરીને જુએ
હરીવરનો લીલ્લોછમ ખેલ..,
અંગાળીએ અવસરનાં સપનાંઓ સાચવવાં, રહેશે ના ઓણ જેચતાણી,
પદ્ધી હરખે ના કેમ પટલાણી?

ખેતરમાં ઊંઘો છે મબલખનો મોટ
અને છોકરાને ઊંઘી છે મુછો,
પટલાણી કહેતી કે જગ્ગો પટેલ,
હુવે આસઆસ ગામ જઈ પુછો.
ઠોસો મારીને કરે સનકારો સહેજ ત્યાં તો, આખીએ વાત સમજાણી
પદ્ધી હરખે ના કેમ પટલાણી?

જુનવાણી ખોરડાનાં નળીયાંને બદલો,
ને ઉંચેરી મેડીયું ચણાવો,
જાણીતા સોનીની પાસે જઈને,
શેર સોનાનો હારલો ઘડાવો.
ધુમાગબંધ ગામ કરવું છે, કણબીની ખાનદાની હોય ના અજાણી,
પદ્ધી હરખે ના કેમ પટલાણી?

ઓણ ધોધમાર પઈડાં છે પાણી,
પદ્ધી હરખે ના કેમ પટલાણી?

--મનસુખ નારીયા

૨૦૦૭માં પ્રકાશિત એમના પ્રથમ કાવ્યસંગ્રહ
'રજકણાથી રક્તકણ' ના પાનાંક
૧૪૫-શીવશંકર પાર્વતી સોસાયટી,
ભાતની વાડી, વરાણી રોડ,
સુરત-૩૮૫ ૦૦૬-ભારત
'કલાપી' શૈન્ટમાં અને 'ઉત્ત્રા જીવણી'માં પુનર્લખન:
ઉત્તમ ગજરા-સુરત
ઑક્ટોબર ૦૮, ૨૦૦૫